

ધ્રુવાંગમણી નેચ. ૪. ૧૫૬

# જૈનધર્મ પ્રકાશ.

The Jaina Dharma Prakash.



માણધાતાચિત્રચિ: એષનદરપે સંયમ: સત્યવાક્ય: ।  
કાલે જાત્યા પ્રદારં યુવતિજનકાયા મૂક્ખભાવ: પરેપામ: ॥  
હૃષ્ણાથોતોવિશ્વંગો શુદ્ધઃ ચ વિજનઃ: સર્વગૂતાનુક્ષણ: ।  
સાધારણ પ્રદેશાસ્ત્રાનુપહતવિધિ: અનુસારે પંથ: ॥

પુસ્તક ર૧ રૂ. આદ્યમ. રૂ. ૧૫૬૨. અંક ડ. ૩૫.

મગદ કર્તા.

શ્રી જૈનધર્મ પ્રકાશ સભા.

જીવનનગર.

પિતૃવાતુઠેન.

|   |                                     |     |
|---|-------------------------------------|-----|
| ૧ | દેન જૈનધર્મસન્દ નેતાયેને મુખના,     | ૧૨૧ |
| ૨ | વિવિધ પિતૃ રાંભદ,                   | ૧૨૫ |
| ૩ | મણિ અને પેરટી,                      | ૧૩૦ |
| ૪ | પુરતોનની પોતાન. (૫ની સાથે પરોપકાર.) | ૧૪૩ |



આદ્યમ. (પુસ્તક ૩૧)

પ્રકાશન કાર્યાલાય,

जीवानियुं रभडतुं भूमीने आशातना करवी नहीं।

बोटनो निवेद्य,

प्रतिक्षमयु देतु.

“किञ्चित् देतुगर्भा प्रतिक्षमयुक्तविधि” के नामनो श्री जगद्गुरु गणेशि द्वात् अथ उन्हें के लैलभाष्यमें अल्पतः उपरोक्ती के देतुं आशात् लापांतर देतुगर्भा वधारा साथै तेयार करीने अमे धर्मा गुद्वर धर्मिमां छपावया भाँडेतुं छ. केने छपाए रहेतां हजु प्रसु अस्ति अथे ते पाका ब्याहुर्गवी व्यवाहीने आपातुं भुक्तन करेत ते खरंतु युक्तनुं प्रभाषु वर्णी ज्वाली अने किंभत लग्नवाग आठ ज्वाना थवानी छेवाली गया वर्षनी अने ज्वालु थवेला क विनी लेवी लेव आपवानुं भुक्तनेर करेतुं छ. तेयार थवेनी तरत रोहतवासां आवरो पशु नवा वर्षनुं लवाज्ज्व गोक्तव्यवानुं आप नमां राख्यनुं पश्यो. गया वर्षनुं लवाज्ज्व गोक्तव्यीने यहां थवेला अपेक्षाने “आपात्वा धार गत उपरनी धार इथा” ती युक्त तो तर्ही दिलेवासां आवरो.

छपाएने भनार पतेव छ.

श्री श्रीदुर्जय महारम्य.

अहात्मा श्री धनेश्वरसुरि द्वात् संस्कृत ‘प्रायात्मक अंशतुं’ अस  
प्रभरेख्यी थवेलुं युक्तसाती लापांतर.

ज्वा युक्ताक्षी अवारी तस्फूर्धी गीलु आपुत्रि लालमां धारुम  
‘प्रायात्मकां अवेक्ष छ. आडुं सुख अने शर्वा लापांतर के देव  
धरु गीला अंशतुं थयुं लोख तो दिप्पुमिलावाडा गुरुप लर्दिय  
हुंक थवेलुं छ. ए अनेमेआटे अमे ‘इस्तीं आवी ज्वारी शाकिं

चांका. निर्णयसागरनी प्रशासनिय छाप, दरवा आपात्मक, उच्चा  
क्रमाना. किंभत ३.२-८-० लवासके भाटे ३. १-१५-०

श्री निपुष्टि शालाका युद्ध वरिन लापांतर.

पर्व १ तुं अने धीयुं.

तिथि ३. २-४-० प्रकाशलां आपेक्षाने भाटे ३. १-१५-०

सालालालने भाटे ३. १-१५-०

सुदूर, मध्य, उत्तर दागम, उत्तम धार्मिक, शुद्ध लापांतर,

# શ્રી જૈનધર્મ મકારા.

જૈન ધર્મની પ્રાચીનતા અને વિશ્વાસ હાજરો.  
મનુષના પારી કરી, કરવા માનવકાશ;  
નેતૃપૂર્વ વિરો કરી, વાચો વિનપકાશ.  
જૈન ધર્મની પ્રાચીનતા અને વિશ્વાસ હાજરો.

મુલાકા ૨૨ જૂન,

રો. ૧૫૩૭ અદ્યાત્મ.

અંક ૬ ટૂંકું

## જૈન કોન્ફરન્સના નેતાઓને સુચના.

કેન કોન્ફરન્સના અનોડ મકારાના લાલ થાણ છે એ શુદ્ધિત હાઈન્ટ છે. આ મહાન સરસ્વતી દાનું તેની પાઠ વિદ્યાના છે, અને તે અસ્તિત્વના રેખે વધુ વર્ણની મુક્તાના પ્રમાણાં ઘણું કામ કરી બતાયું છે. મનુષના જીવિતાસમાં એ નાણું રહે જો કાંઈ ગુજુ મેરો સમય નથી; અને મનુષના દેખાવ નાં અધી નાણ જગતનાની સર્વાચારે સ્વાપ્નિય થાય જાસથિ મેળવતાં હોયાં વારો અધી નાણ એ તદ્વાન પણના જોગ છે. જૈન ડામના આગેવાનાં દાર્શનિકી અને કેન બાળભેદની નરી પાયતો સાથે નેતાઓ જવાનાં અધ્યાત્મા નાયાદી એક મેરો પણ હુર સર્વ ગયો છે; શુદ્ધ આ શયના જીવાદર્થના મનુષ્યાઓથી અધ્યાત્મેલા જ્ઞાનાનું સરસ્વતી સર્વી રીતે પ્રશિદ્ધ પાખી હું છે; હેઠ કેન કર્વીકલાં જાય કેસે ગોયાં પોતાની ફરજ સમજી છે અને કામ કરવાનાં પોતાની જાન સાંદુરું રખને છે. દિંહુસ્તાનના વોડોનો જીવ જ્ઞાન નિયમ કર્યો છે કે ને કેંદ્ર મનુષ્ય નરીન પ્રચાર અલારનામાં હાજે તો પણ તે ગરે તેરાં પરિપક્ત, શુદ્ધિત અનુસરતો, સમર્પણિત આત્મા કેનારો અને વિચારસ્થાન બાળજીગારાં વિકલ્પોનો હોય તેમણું તેની અને બંધી. કેનાંઓનો આ વિનિયાયા જાણાં રહ્યું હાજું નહિ એ તેનું

४८२

## थी केवल वृत्ति अदाशा,

अद्योन्नाम्य भगवत्तराता छ. ऐसुं कारण सह छ. त्रिसना आजेष्यमो वृष्टि  
भगवत्ता उपेष्यतां प्रकृत्यार छ, अम वृष्टिमो मुख आवे छ ते  
तेच्चा कशी राते छ; अने कशीने प्रथमधीय तेज भावे द्वापा थेजे छ  
केव्याने डान्दूसन्सना अंतरकारिता लग्नुलय दहो तेजो आ रसगता करे  
आन गुण्य लक्षित छे क्षेत्रानी छ क आपी उच्चाव देवा डाम फसाय  
हरी गम देने आटे तेने मुण्डक्याठी आपारा विवाह दर्शे डान्दूसन्स  
कार्यक्रमां उट्टीक अग्रलनी कुरुत्यां याप छ ते आन दाँड़ामां आर्ते हे  
केव्या डान्दूसन्सना कार्ते भाटे मुख्य रीते व्यापारार छे तेजोज्ये आ द्वा  
क्ष आपा आनार देवानी बहर छ.

डान्दूसन्सना प्रमुण छेक छेली धरीम चुदी क्षारामां आवे छ असी  
तेच्चा डान्दूसन्सना प्रमुण तरक्षी नेवाली नीपारी थाप चाहनी नाही. जेवा डेव  
गोपामां भोट्टु आपी शक्त ऐसुं ते आन देवाने भाष्यकाणी यनासना गोपामाम  
छ गवार वयतो नीक्कावा नेवाली ने अृथत्य द्वावा लेहजो. भरतु आपार द्वावी  
ना प्रमुणना आपाङ्गाम द्वित्यानुं विन्द रुप्त अप्पाए आवे छ. प्रमुणना  
लापलु उपरक आपी डान्दूसन्सनी इतोडो आपार छ. आ आपात आप  
लक्षपर देवानी बहर छ. वर्ण डान्दूसन्सना प्रमुण चाहाने डेव लापक म  
लाय जे पछ निष्ठा थवानी बहर छ. घनात्यं गृहस्थीने नेवा जे रथा  
आपामां आवे छ तेच्चा अवासन्तार विद्वानोनि पछु ए रथान भग्न  
नेवालो. आपा करीने जे जल्यापर छ तो विद्वानोपर छ, पछु जे धर  
वान आवे विद्वान वने होय तो सर्व प्रधासना वाप्ति जल्यापर रहेवान  
संबन्ध छे.

जोर रीते विषयनी पराह्यी करता भाटे प्रथमधी नियार डस्यार  
बहर छ. छेली धरीम नगे ते विषयी वृष्ट देवा पडे तो डान्दूसन्सना आ  
भावे खडे. अने भाटे दीतरसनी गोहायु नेवालो. सर्वथी सारो उपाय से  
नीर्ति इच्छी दरेक गोया शहेरमां नीमयामो छे. गर्भ डान्दूसन्स पर्याप्त  
आपी गोपाना थाप दत्ती, भरतु ते उट्टेव दरक्के अभवामां आपी ते नाण्युस  
नवा. पर्याप्त शेष्टरीजो नीमयामां आव्या छ, तेजो गोपानोपाना सहु  
च्छया उद्धाना आपेचान-विद्वान अने धनवानानी जेक इच्छी करी डान्दू  
सन्सना रेष्टरीजोपर गोपाना उद्धानी बहरीच्छात, आपी देशनी बहरीच्छ  
निवेद आपानोपर गोपाना विचारी भोक्त्रे, अनो ते निचारीनी निष्ठम

जैन कौटुम्बसंसाधा मेत्याम्भानि गुरुत्वाः

१२३

अथवा कर्त्ता आद डोन्हरना नरकथी थार सेहेटरीमा योग्य भाष्यसंनी संवाद लाभ डोन्हरना लरवा पूर्वों एवं भास सुधारानां अर्था करवाना विषयो जलदरमा भृत तो लेकिं तो भाट तिथार थार। उपर्यु योजना न नीभी शके ऐवी नथी, छला इन्हु ऐम लागे छे के ए कठाय नीभी शक्ते नहि तेन् कारण स्पष्ट हे डोन्हरना एवं शशीर हे; ऐमां प्रतेक अण जेहुओं तेवी शीते काम उडानां नथी, एवं प्रतेक अणांनी इरव शी छे अने इरव आद करवाते इडे क्रमे आणे अमावेव के ए नेपछ्ये तेहुत्तुं क्षेवाभान्न आम्हु नथी, डोन्हरन्हे डेवी योजनाओं काम उडवुं ए नक्की क्यी पहेलां हुं उडवुं एवं वाचर आदी दीवुं छे; ऐमां दर्शकम्भाव विषयास पाणी गयेव तो ने आम्हां डोन्हर भासां वापु वाग्यसामा वरावानारो डोधपलु प्रेत आस वर्णवानी बरव देवा तो आ छे के डोन्हरन्सनी योजनाम्यो अमलमां भृत्या भाटे डेवुं अमावेव उडवुं नेपछ्ये? नेवी शीते सरकारमां गवर्नरथी आप इमिन्यानी गोलीस नुची एक वीजनामा लाव नीवी एवा रीतसन गो-  
पाप गेवा हेव छे के विषयात काम याचा करे छे ऐवीज रीतेजनरल शेहटी, ग्रामी-शीघ्रव सेहेटी, लोकल सेहेटी, स्टेन्टीग कमीटी, वर्क्स बोर्ड, नेक्टर बोर्ड, ग्रामी सुव्यवस्थात राते गेहवतुं नेपछ्ये के तेव्हा आपांनी इरवीयान योग्य सहानामी डीनी करे अने विषयो शुं लेवा, डेवा क्षेवुं अल्ले लेवा, शामाटे लेवा, एवं भृत्या अताती शडे।

आ योजना यास वर्णे वडोदरामां वडापेलीन छे, तेथी अन्न ते पर विशेष विवेचन करवानी बरव नथी, ने आव इहेवाहुं छे ते जेव छे के आपा वर्णां वालु दिसा भागी सखना कराव उपर्यांत डोन्हरन्से गेवी योजना अमलमां भृत्यी नेपछ्ये के नेव अहो एक वर्षत गति आप्या/ इती तेवी भरी सुवाला जानावेली हेव अने तेव्हा तेव्हा नांगेहुं हेव तेव्हा शो देवसो इरा इरा करे छे तेवीज राते डोन्हरन्सतुं त्रिषु विवसतुं सूची-पत्र अेहुं ग्रेव भानावतुं नेपछ्ये के आम्हु वर्षी तेवी गति श्वेष रीते याच्या करे, एक मुदानी जात याच घालानां राखवानी छे अने ते एव्हे के डोर्फी पत्र कर्वी आराम यासा फडी ते संख्यावी विचार याले छे, फडी तेव्हा अमलमां उडानामी योजना यास छे, अने फडी ते अमलमां भृत्यां छे, डोन्हरन्स वेळन भागी विचारवत करे तो भृत्या क्षर्य-सिद्धिगो प्रथम आरो याच्यात करे छे, राहीं गवानी इटो नेवी यात्र वीजन पायापर प्रेत्तुं-

४२५

## श्री देवन देवी नियम.

आपामो प्रवल कर्त्ता के नियम हैं, जिनमें श्रीकृष्ण ने सभ्य छोड़ के भेदभाव स्वरूपी ने विचारमाला, कठजल आदि अन्त शर्वस्यस्य विनाशीया था। जो ने अनुग्रह कर दिया गया उपायी इसमें आपामो ज्ञानान्तर नहीं था।

इन नियमों वर्ते अब देवलीक सरना कर्त्तामां आवे हैं, जिनमें भेदभाव कर्त्तामां देवकृष्ण अते नेत्री शक्तिता के बो ध्यानमां अपामो ज्ञेष्ठाये, केन्द्रस्त्रिया वाणीक हैं, तेथा तेना आपा भवत्युत थाय तां तुर्मु विषयान्ति प्रभावी रर्वमान्तनाना रामान्य नियमया कर्त्ती ज्ञेष्ठाये, याकुर्म पर्वान्द इरेव विषय अभ्यामां भृषी शक्ताय तेबो देवी ज्ञेष्ठाये, नदृष्ट भट्टा नियमामां तें अभ्यामां गुरुमानी जेवनामा पश्च रामि आपामी गोमण्डो आपामी परिष्याम लाकु राह आपामो जेमां संशय नहीं, आपामां उद्वाक नियमों तरह देवलीक वार ध्यान रहेतु नहीं तेनु अरथ उत्ताप्त हैं।

केन्द्रस्त्री सांसारिक सरावेन्द्र आपा आपामी लाकु नदृष्ट हैं, आपा लग्न, भरथ भ्रस्त्री रहेतु कर्त्तु, कल्पविद्य नियमे रर्वमाना नियमों को देवामां आवे हैं, क्ये विचारमां केन्द्री सामाव आं है के केन्द्रस्त्री अन्ती वधारे द्वायामुना नियमों प्रकेश करी यांके के नहि ? एं लाकु विचारमान हकीकत है अने तेआं सर्वी भान्तनाना नियमों गोद आवे तो आपा कर्त्ता दुर्द्वापान थध ज्वालो संबल दृष्ट्यन थाय है को यात अही है, ज्वां लाकु देवामणी तहन कमिक्तीं देवलीक नियम-शीत-दीर्घ वर केन्द्रस्त्री तरहम सरना हैं आपामृप अभियान भद्रार आपों के लाकु व्यवहारुं हैं आपा भवत्यन केन्द्रस्त्रीना नेत्रामोना लक्ष्यपर आपामामों आवे हैं।

देवलीकुना नियमों ज्ञेष्ठाये तेष्ठी अगत्यता आपामो भेदभावमाना आ जेतामो भवुत थया है, ज्वां लाकु तुमी अेक रखु केन्द्रस्त्रीयां वक्तामें ते नियमपर रहेतु असारकरक अने नियतार्थी लोकु ज्ञेष्ठाये तेष्ठी नहीं नयो; अनो केन्द्री अरेखरी आपास्त्रवता है तेया व्यापक्तुं नियमों भर्त्यूदै नाय भवती नहीं, आपा वर्षी ज्ञेष्ठी आपों दिव्यन आपा व्याप्तुं भवत्यन देवतानामा विषयने आपों उचित है के नहि ? ते शब्दमुद्दी आपों अ विचार थवामरे।

कैन मुक्तदोहारमो विषय अर्थामां आवो है, लाकु तेना संलग्न ज्ञेष्ठाये तेष्ठुं थयुं नहीं, जेसद्यामीरो लंदार उद्यामों ते अेक काम थयुं है विद्वान देवतारों रामों केया भ्रो, पीयस्त्रस्त्र व्यवे हो, वामों

## વિવિધ વિષય શંખાદ.

૧૨૫

કે રહ્યાં હોય છે કે જો જીવિત કોઈ કર્માં નોંધશે; અને જ્ઞાન કર્માં કોઈ મંજુરી લાગશેરી કર્માંની કે તેને માટે પ્રયત્ન કરવો જોશશે. હવેનું કેવી પ્રયત્ને કે, કોઈજાંની લાયું કે કે “The energy of the Jains deserves credit, but it is to be desired that it may be aided by some central organisation”. તેણે ઈરિયાં કરે છે કે કોઈ ભાગના ડોડી જીવની હોય કે કોઈ સમાચાર ભગવાના હોય કે કોઈ નાના વિજ્ઞાની રોપ તો તેને માટે એક સૌંદ્રે ખાતું મુખ્યમાં હોય નોંધશે. આ મુસળ્ના જ્ઞાન ધ્યાનપર બેનાની છે.

તો ઇન્દ્રસં કોઈ કરી શકે નથી અનેક દેનના કામનો સરવાળો એ ડોન્ડ-અન્ડ-સમાન કાગળો સરવાળો. એને જ્ઞાને થારીના દેંક અવયવો સુવ્યાવસ્થાની રીતે કાળ કરવા લાગશે તારે જ્ઞાનું ગરીબ માન કરવો અખખત કેમેન્ઝ-અન્ડ-સોકનાળા કે કરેલા કાર્યક્રમ ઇશગળની અસર ઉપજનની શકે છે, પણ પણ કાળ કરાર નોંધશે, હેંક કેનનાં જ્ઞાન ફરજ છે કે ડોન્ડરસનાં ક્રમને આખલાંના ચુક્કાના ચાર તેણું જનાની પ્રયાસ કરવી.

ડોન્ડરસં જરૂર માટે જીવિતશૈખ જાંકે કરેલે નહિ એ વિચાર હીક છે અનું તદ્વાનું જાણાનું કરું એ, ગણું જાણાનું ભરેલું નથી. એનો નિયમ જે કે કાલો ફશયલિંગ પ્રારૂપ નાનુંથી કેશથી જાબ્બાઈએર તરફ જાણ જાણે છે. આપણે એથ પ્રારૂપ જગ્યાને ડોન્ડરસાચા નથી, એણું તેણેસે નેચ્ચેની ફરજ તરફ જાણ એંગ્લા કાખાના માટે તેણું આંકડેણું કરું છે, માંચ ડોન્ડરસનો મંજુરીની ફરજ જાણાનું કરી નાખનો એ સુધ્યાના ડેટાઓ ચલ્યાનાની જગતાં અનુકરણ કરવા નેવી લાગતી નથી.

એવી એક રીતે, જ્ઞાનાંના જ્ઞાની કેવાનું જાણે તેમ કંઈ કરાંનું જીવાળાં કાર્ય કરતાંને જાણારુંનાં હારું જાણે છે. મોચિનિક.

## વિવિધ વિષય શંખાદ.

જીનમહીરસાં જાણવા ચેણ્ય હશે વિડોનું સ્વદ્ધય.

૧ નિસ્તાલીલિનિક—ગળુંધર નિસ્તાલી, ૨ પદહિલાલિનિક, ૩ પણુભાલિનિક,  
ફુલાલિનિક, ૪ જાગુભાલિનિક, ૫ નિદીલા નિર્દીલાનું નિર્દીલિનિક, ૬ પાદલંબ ફુ-

४८५

## શ્રી કૈતેન ધર્મ પ્રકાશ.

ગાંડિલનિદ, ૮ પણુદિકચિક, ૯ ગુદાવિક ગતે ૧૦ પણેસાનનિદ. અન્યો ચિકાનું ચંદ્રોગંધી બાળાચરનો ગાડે નિવેદન કરયું. તેમાં પ્રથમ નિસ્રાણી વિકનો અર્થ નથુનાર નિસ્રાણી થાય છે. તેમાં જરી પરમાર્થ નહિ સમાન નારા બેણા ભક્તો પોપટની માદ્રક ઇકલ પણુની પાંચે નિસ્રાણી નિસ્રાણી પદ્ધા કરે છે તેમનો લક્ષ્ય કુમારના માટે આ ઉદ્દેશ છે તે લક્ષ્યાં જી આ દેશક વિકનો પરમાર્થ ચેને સમજ થીન મુજબ છેંને તે સમજના ચેતાનાની યોગ્ય દુરજ વિચારી કૃત ઉદ્દેશ સાર્થક કરશો.

૨ નિસ્રાણીદ્વારાનિદ—પ્રથમ શ્રી જિતેનથરની જગતિ (કોટ) ના દાદા પેસતાં પેતાના ધર સંખ્યાંની બાધારનો લાગ-નિંદા હરતા રૂપ પણેલી નિસ્રાણી કંઈએ. પ્રદક્ષિણા ઇરીને દેખાતી આચારના ટાળની મધ્યે દાદા પેસતાં શ્રી જિતનગદિર સંખ્યાંની બાધાર-નિકલ્યને તરતા રૂપ થીજ નિસ્રાણી કરેલી. પછી વિચિત્રત સાધન ( અશત, દ્રષ્ટ, નવેદ્યાહ ) શ્રી શ્રી જિતના કરી દ્વયપૂન સંખ્યાંની વિકલ્પ તરતા રૂપ નીકલ નિસ્રાણી કરી શ્રી જિતને પણુની રતું માટે ચૈલ્યવંદનવિધિ સાચારી. નિશ્ચરતાસેણે મર્વાચારની જી ભાવની નિશ્ચિહ્ન થાય તેવા પ્રભુના સહશૂલ શુદ્ધેનું કિર્તૃત કરયું.

૩ પ્રદક્ષિણાનિદ—પણુની જમણી બાળુથી બાળગણ્ય નિવારણ જુહિયી વા શાન દર્શન ચારિવ પામતાની સુષુપ્તિથી શ્રી જિતનમાદીરની કુતામાં જાયણું પૂર્વેક માર્ગમાં કોઈ પણ પકુ પ્રકારની આચારના કર્તૃ દેખાય ગાતે ( જાતો ) હૂર કરી ક વાળ પાંચે હૂર કરાયી નથુનાર ઉપરોગથી મણ કરસું તે.

૪ પ્રશ્નામનિદ—ગમે તેથે હુરથી જ્યારે શ્રી જિતેનથર પણું જ થાય ત્યારે તરત એ લાય આદર પૂર્વેક જોઈ ‘અંજલિમાદ્ર’ નમસ્કર, રીએ તે પ્રથમ પ્રણામ. પછી પ્રદક્ષિણાનિદ કરી નિષ્ઠારમાં આપી જી સમાપે અધે અંગ નમાદાન રૂપ ‘અર્ધાચનનત’ કરીએ તે એને પ્રણ મ. છેવટ પણુની યથા અનસર દ્વયે પૂજન કરી ચૈલ્યવંદન પંહુલાં પાંચે: ગ ( એ લાય તથા એ તથા જાતુ મસ્તક ) તે સાપ્તાર્ણું લગ્ન સાથે રૂપ વાવડે ‘મંચાંગ પ્રશ્નામ’ વણુ વાર ભૂમિને પૂજુ પ્રગારિને કરીએ નીજે પ્રશ્નામ.

૫ પૂજનનિદ—યથા અનસર સતારે, મદ્યાનદે તથા સાંજે યાંદોનિન કુતામ દર્શાયી પૂજન કરી જુહસ્થોને કરી છે. તેમાં પ્રલાતે

## ચિદિશી વિષય રાંથદુ.

૧૨૫

સાહિત્યની શુદ્ધિની નારાણાની પૂજા, મધ્યાનહેઠ સુગંધી જળ, ચંદન, પુષ્પ, પૂષ્પ, દીપ, અદ્ભુત, દૃગ અને તૈવનાડે અધ્યપકારી પૂજા તથા સાહેબસુગંધાની પૂષ્પ દ્વારાહિન્કવદે પૂજાનો અધ્યક્ષાર છે તે સુલભ ભાનિક સહયોગથી યથાવિધિ પ્રભુનાંતિ કરી સન્મન્યનો લાભનોં લઈ શકે નેત્રે દર્શયો ( શુદ્ધ જળ, ચંદન, પુષ્પાદિક ) પ્રભુના અગે ચાદરી શક્તાય તેતેવડે અધ્યાત્મપૂજાનું કરવી તે પ્રથમ પૂજા કરે દર્શયો ( સુખની ધૂપ, દીપ, અદ્ભુત, દૃગ, તૈવના ધીનિક ) પ્રભુની ચાગળ ટોડી લાવના ભવાય તેતેવડે ‘ અધ્યાત્મપૂજા ’ કરયા હી પ્રથમ પૂજા. તેનાં સર્વ દ્વારાપૂજાનું કર્યા બાદ પ્રભુના સાલ શુદ્ધાની અંતઃકરણથી તેવાં કરાતાનું પામના માટે સુત્તિ કરીએ તે ‘ ભાવપૂજા ’ નીચ રામનાની. પરાયાર લક્ષ્ય ચાણી જાળણા પૂર્ણક રાખેઓના સુલભ પરમાનંદ્ય પ્રભુની ઉકાત નણે પડારે સ્વરસ અધ્યક્ષાર પ્રમાણે પૂજા કરનાર પોદે કુલપદ્મો પણે છે. ગોતે પરમાત્માની ધ્યાન બૂજાની નજર નથી. પણ તાં સુધી તો યથા સંભવ પરમાદ્યપ્રભુની પૂર્ણ આસ્થાથી પરમાત્મપ્રભુની પૂર્ણ આસ્થાથી પૂજા કરવામાં આવસ્યકતા છેન.

**૫ આનિસ્થાનિક—પરમાત્માનું પ્રભુની છદ્રસ્થ, ડેવળી અને સિદ્ધ એમ વણું ચેયસ્થા જુદે જુદે પ્રસંગે લાવની. તે જેવી રીતે કે પ્રભુને નવસ્થ (સ્નાન અલિપેક ) આર્થિન વિનિરે કરતાં ‘ છદ્રસ્થ ’ અછ પ્રાતિદાર્યાના દેખાવથી ‘ ડેવળી ’ અને પર્યક આગામે, પ્રમાણે કે ‘ કાઉસર્ગું શુદ્ધાયે સ્વિત પ્રભુની ‘ રિદ્ધ ’ આનસ્થા લાવની.**

**૬ ચિદિશી નિરીક્ષણ વિરતિચિક—પરમાત્મ પ્રભુની પર્ચિન કે તિમાં રિચિક નણોંને પ્રભુના સાનુષાંજ પોતાની દર્શિ સ્થાપવી, તે શિખાયની નણે દિશાએ દર્શિ કરતાનોં લાગ કરવો.**

**૭ પાદ લૂભિ પ્રમાર્જનિનિચિક—શુદ્ધાયે પ્રભુની દ્વારાપૂજાનું કર્યો જાનું ભાવપૂજા-ચૈતાનંદન સમાને જાળણા પૂર્ણક વરાંચણ ( ઉત્તરાસ-ગન્ય છેણ ) વડે નષ્ટાતાર પર્યાંગ પ્રેષ્ણાંગ કરતાં લૂભિ નિનોરેતું અયરલ્સા માટે પ્રમાર્જન કરવું શુદ્ધિ વિનિરે ભાવપૂજનના અધ્યક્ષારી વગે રુનોડરણ્યાદિક ઉપકરણથી નષ્ટાતાર પરમાર્જન પૂર્ણક પ્રભુને પર્યાંગ કરી ચૈતાનંદન કરવું.**

**૮ વહીાહિનીચિક—ઓ નિનોદર પાસે ઉદ્ઘાટ, મધ્યમ કે લઘનાં ( આનુક્રમે બાઢ વોધ કે ચાર થોડી કે જોકાન થોડાથી ) ચૈતાનંદન કરતાં તે તે સુનાશાં, ચાદરી નો અગોમાં પરાયાર લક્ષ્ય ચાંદ રામના સાથે ઓ નિનું**

१२८

## श्री जैन धर्म प्रकाश।

प्रतिभानुं दृढ़ आवासन राखतुं कारबु के उपयोग शत्यतांगे करेती ही  
एही चढ़ान न थाय।

**८ सुद्राविक—जैत्यवंश करतां नमुच्छुणुं भवतां सुधी धागमुदा**  
धारी राखती काउसगध्याने रहेतां ‘जिन्नसुदा’ करती तथा प्रणिधान  
विक ( जलवृत्तिएठियाई, ज्ञातवृत्तिसाहू अने जलवृत्तिराय ) उच्चरत  
‘सुखायुक्ति सुदा’ धारती भाष्टोगांधी कमगाना डायनी ऐरे धीरों  
वडे दृढ़ आंगणीओने आंतरी आपस्था ऐरे उत्तर अने लाखी द्वायुं  
स्थापवातउ ‘धागमुदा’ थड़ गण्याय। चार आंगण आगगाना बागण  
अने तेथी ठंडक न्यून वाढगाना बागगां पर फेणागा राखती काउसग  
करते ते ‘जिन्नसुदा’ थड़ समजती भाष्टोगांधी आंगणीओने नहीं  
आंतरतां ओक घीछु आंगणीओने सादे लगावी अने लाख उत्तर गर्निं  
( गोवा ) राखतामां आवे अने ते अने लायी लाख ( काळा ) रथ  
आडगाना आवे ( घील आचार्याना भते वाणीरथे लगाडगानां न गव  
आवे ) ऐम करतां ने सुदा थाय ते ‘सुखासुक्ति सुदा’

**९ प्रणिधानविक—उपर जलाव्या सुवर्ण ज्ञानिको ज्ञानतो**  
अने जलवृत्तिराय ए त्रैषु सद्वाहने ‘प्रणिधान विक’ कहे छे, अथव  
मन वयन अने क्षासाना योगानी एकायता पथ प्रणिधानविक कहेवाय छे।

उपर प्रभावे दृढ़ चिह्नों भुवासे संकेपथी धूरो थें ते उपरों  
उट्टलीक प्रसंगेपान भाणतोपर भक्तिरसिङ्गोने लहु आपानुं जररहुं हैं  
आज ज्ञान प्राप्तीओ प्रगाहने वथ थड़ पवित्र प्रभुरूपादिक नित्य निष्ठेदृ  
पलु भद्रुद्या अनिहिते ऐवता नवरे पडे क्षे ते कंधक नीयेनी बाल  
परथी समज शिशारी; तेगर ते समज्जो स्वपनना सुमारा भाटे धनी  
शीघ्र राखतामां आवरी।

धूरं क्षेत्री रासामर्दीदायी जिन्नसुदानो, जिन्नसुदिगानो, प्रविष्टा ( तुर्फ  
दित सादु पाले विधिवत् रासदोपाहितां ), तुमगमित निंगेरे गवित श  
स्वर्णाति मुजरय वर्तवाना अभी सुआवडो करता दत्ता तेता आदर-पडु भाँ  
भूर्तु ज्ञान ज्ञान वाजेवर धतुं देखाय छे। उत्तरं गाव्यविधिगो अनाह  
थतो देखाय छे। प्रभुभक्तिमां रासतां दग्धेना जलनामृतं इस्ती देखान  
शुद्धिनी उपेक्षा करतामां आवे छे। भद्रुद्या आदरीच्या प्रदानी॥ ऐरे संग्रहं  
अननुङ्गान डिया कराती वरपुण छे।

## विविध विषय संबंध.

१९४८

आपा विज्ञानामां केवला विग्रेरे साचाता नेवी काण्डा राखनी जेष्ठो तेवी रुआती हैआती नथी. क्यवित् तेनो ऐदरकारीथी दोष थतो हैसाय छे, अन्यित् चोरार्ह जाय छे, स्वन्यित् गच्छाती जवाय छे, प्रभुनी पवित्र भवित्वुं काम अडुधा वेहनी केम बजावतामां आवे छे. हीवामां एवा विग्रे छोगे पडी भरे तेनी प्रायः संजाण देवामां आवती नथी. ज्ञनमहिरा अडु मोटी रात चुक्की खुल्ला राखतामां आवे छे. प्रायः अवसरतुं काम आप्तुं सरे करवामां आवतुं नथी अटलुंज नहि पशु आपणी भुक्ति सुधारवा डोध ग्रेस्युं करे तो ते वजोडी काढी पेते हाड करे छे एम स्थापी कटलाह विष्णे वसारे छे. आ सर्व अरेखर आगाननोर प्रभाव छे. आपणी पवित्र शासनशासी वीरपुत्रेवा लवे वधारे बागृत थागानी लवर छे. आपणी आप्तुं ट्वी जापा पवित्र विथनि आवा अनेक अविभिदेष्टुं परिष्णाम ज्ञाय छे. ज्यां चुम्हा आजान-अविवेक-मित्यालिमान टाक्की नहि त्यां सुधी आपणी डेगानी रिथनि शुभरती णाडु शुक्केव छे. शुविवेक धार्या विना आपणे आप्तुं परम उपगारी परभात्म प्रभुनी पवित्र आगाने विवित् पाणी शक्त्युं नहि, अने ते विना आपणे ते ते दर्गडरणी करनां छतां पथार्थ लाभ भेणनी शक्त्युं नहि एम सगङ्ग आरा वालावा वीरपुत्रेवा आने वीरपुत्रीओ। तमे ज्ञो. प्रगाढ़ी गदाशतुनो भव्यो होठो, अने भनामां शुभ बागणी लानी परम दृष्टाणु प्रभुना पवित्र आगाने अरालर भागवा लत्पर थाओ। तमे भनामां धारो ते डरी लडा तेम छो, डेङ्के तमे वीर पुन तुनी छो। छतां केम यणायीर घडगाना टोगालां रहेवायी सिंलिशार पशु गोतातुं स्वदृप भूती जाय तेम आजान, अविवेक, गिय्या लहेम, कायरता विग्रे दोषेना सभदमां एकमेकपशु रहेवायी तगाह लान डेकावे रहेव नथी ते छने डेकेषु आवे ज्ञो श्री वीतराम प्रभुपति प्रतिदिन प्रार्थना छे ते सदृश थोओ। स्वपरदतुं आंतःकरणाथी शेय उच्छ्वास दोइ वीरपुत्रे नेम श्रीकैनशासननो इह्य थाय तेम डेड डर्जी उवाग करवो इवित छे. पुरुषार्थने कंध आप्तार्थ नथी भाटे ज्ञो उत्तर तुनीर्थुन आपणे सर्वने शरणु हो।

तथास्तु ! ! !

संनिभन्न कर्पूरविषयः

## મહિને મોતી.

( કલિપત વાર્તા.)

“મા ! આપણા તું કેવી જીવિત છો ? તોરે જાઈર કરો જીવિતાની રીત ? જીવિતાની એક રીતને ધરતાં પ્રવેશ કરુંની માને સુનેતી રોચક ગોત્તીની પોતાનું હૃતર હેઠળું ભરતાં પુષ્યાઃ”

“નહેન ! આજે ગણું નથી આપ્યો, તે પાછળ કેવ રહ્યો ? આજે જાસ શરીરનાં કાગતર ધાર છે અને આસાની જલ્લાલ છે તેથી જરૂર ચુંચી છુંચ.

“અણ્ણુભાઈ મારી સાધેન ટ્રેનમાં હનો ખણું તે ચાર્ચારાડ હતી હીરા શેષાણી પાસે ગેરો છે. આજે સવારે ભાઇને મેં કણું હતું કે મને એટાણ કામ આપડે છે, કેર ભરતાં આપડે છે અને હું યસુપય ખણુંચી ચાડું છુંચ, તેથી તેવું ને કાંઈ કામ હેઠળો લેખન કર્યા પણીના હૃતરદાન વખતમાં જાની શકે. હીરા શેષાણી ગારે માટે તેવું કાંઈ કામ આપે તો મેં તેવે લેવા શેડદ્યો છે.”

“અહિને ! તું એવી હૃતરદાન કર્યાની ભગાડી હુંમણાં ગારી તાપીનાં જાસ રહે છે તેથી તારે ધરકાનમાં ખણું વાપરે ગફા આપવી પડેયે”

“તોણી કાંઈ રીકર નથી. તું સવારે જરૂર બંદેલી છડાશ ને ધરકાન ખણું હકેલી દૃઢશ. વળી રૂનને દિવ્યસે તો વળો વખત ભલે છે. મા ! તું હુંમણાં ખણું સાખ્તા કાગ કરે છે. ભાઈ આજે કંદુતો લોત કે તું ને આતી રીતે સામત મહેનત કરીશ તો તારી તરીપત વધારી પડેયે”

“મોતી!! કામ ન કરીશે તો આપણો ધરમસાર કેમ ચાલે ? આપણે ઝંદગી સુખમાં ચુનારણી હેઠળો આપણે મહેનત કરવીજ નોટાયે. તું જાળે છે કે હુંમણાં ધરમાં આપણે કદલી તંગી બોગવતી પડું છે ?”

પોતાની માન આ રાણી સાંભળી મોતી ચુપ અધ ગાધ. ધરમાં તંગી બોગવતી પડે છે તેવી મોતીને આજ ચુંચી અપર નહાતી; તે જિચારી ખાંડક હતી અને તેથા તેની માણે તેને જાળ્યાનું પણ નદતું. તેના પિતા મોહનલાલ કાળીઆવાદમાં જનનગરના વતાની હતા. તંગીએ મેટ્રીચુંબન ચુંચી અભ્યાસ કરી તે પરીક્ષા પાસ કરી હતી. તેની વર્સિલુક શાંત હતી, વર્તત નીતિમાન હતું, અને જીવમાને મીતનમાર હતો. નાનાં ઉમરથી નોકરી

## જીવિકું જાને માત્રાત્મિ.

૧૩૨

જાર જીવાત હતો તેથો રૂપ કોણા પછી તેઓ કાંઈ સ્વતંત્ર ઘંધને ભર્યું મુખ્યાં આપ્યા હતો. એટાની ભરક કે કોણપાણું ન હોનાથી ડેટસોંચ. જાત દરમા સંખ્યાંની વિવારણાં ગણે. છેઠે જેવેરી અનુરમાં મોતીની દ્વાલી કરતા નાન જાણું હતો તે માત્રે પદસો. જોકાડ વર્તતો માંડમાં શુદ્ધાનું થાં બાંગ વેદયી પેદાન થાં, પણ રહ્યાનો મોહનસાર હોનાથી થોણો વધ્યાનાં એ જાર રૂપની શેરિન્યાયોળી તેના ઉપર પ્રોત્સિ થઈ, અને દ્વાલી સાતી રણા ક્ષમા. મોતીના રોગ પોતાની કરતું શક તો તેના વિનિય, નાનાં, ચાહુટા રિંગેર શુદ્ધાની તો ખાડું ચલતા, અને તેને સુખી કરવા આતુર જગ્યાતા. એ ત્રણ વાં એમ સારી રીતે ચાચા તે અરસામાં મોહનલાલ ચુણે શુદ્ધરતાન ચક્કારાના ઉપરોં ત્રણ ચાર લક્ષ્ય ઇન્ધ્યાની પુણુ કરી રાફ્યા.

તેવાળાં સુંભાઈનાં દુષ્ટ ગરકાનો ઉપદ્રવ શરૂ થયેટા ગરીયું. તચેંગર, ચુનાન, દૃષ્ટ ધર્યું ગાણ્યો ગરકાના રાસારામાં આવી ગયા. લોડા તેથો નાંન ભાગ કરતા મંદ્યા, પરંતુ ગરકા તો નિરસનતી થઈ પડી એટાને સુખી ચુંફુરોસે ગરકાર પરસમાં રહેવા જાયા, અને રાંધારણ ગાણ્યા. બહાર રહેવાના શક્તિ નહીં હોવાની બાબી જો તે અહે એમ ધારી નિઃશાંક થયા. મોહનલાલ શુંગ હતો, રાયાની શક્તિનાં હતો તેથી તેણે નિઃશાંક ન જેનતા અને અરસાનાં નંબેંક હન્દે ઇન્ધ્યા અરચી દેરાસરની લાં સંગવડ હોવાની આપીભાનાં ગિંક અંગલાધારાટું નાંનું ભકાન લીધું, અને પોતાના કુરુથું સાયે લાંદ રહેવા જાળો. તેનાં જી ગંગા ઝાલી, સાથી સારી ચોપડીઓ વાંચતી અને પ્રસન્ન સ્વભાવવાળી હોવાની પાણે મેસ્ટ્રો આવની સ્વીકોને સારો સારાં દ્યાંત આપી બોધ આપતો. રદે મોહનલાલ ખાંચે પણ ગાહીભાનાં રહેનારા કાઢીઓયાદી પુરુષો અને પીળા પાડાસીઓ પણ્યી ચાર આવતા અને મોહનલાલ લતેને સારી સારી શિખાગણની પાતો કઢેતો આથી રેણ્યા. મોહનલાલને મારતર કઢેતા અને સ્લીઝેસ જનાને ગંગાને અદ્યતે દાઢી બહેન કઢીને બોલાવતી. જી પુરુષો અને રાણ્ણ સ્વભાવના હોવાની તેનો ધરસાસાર સર્વી સમાન સુખદૃપ ચાલતો હતો.

પરંતુ આ રાંધારાં હંમેશા એક શરખું ચાદુંનું નથી, અને અસ્ત દિદ્ય-શુણ દુઃખાના એક દ્વારાન કરે છે. મોહનલાલ અને ગંગાના સંખ્યાંમાં

૪૩૨

## શ્રી કોબા ધર્મે પ્રકાશ.

પણ તેમજ થયું કુરરતે હોએ જ્ઞાના રીતનું વચ્ચે લોયું. મોહનવાલની તર્ણીયત અગડી, તેને સંમાનિતે વ્યાખ્યા લાગુ પડ્યો અને હિંદે હિંદે શરીર કુદુરું ગયું. તેની ઓછી ધાર્મિ જીવનની આરતાર કરી, પોતાની સહારણું વિશ્વાસી છતાં એક ગૃહદય પેંડ ક્રીયાપ્રેરણારણાં અને કોણો પણ નથી તર્ણા વિપરીત હોવાથી કાંઈ પળ દ્વારા પડ્યો નહીં અને તે કાળનો બોંગ અચ પડ્યો.

મોહનવાલના ગૃહ્ય સમયે તેમને એક પુત્ર અને એક પુરી ઓંગ ને સંતાન હતા. ભણિવાલની ડંભર તે કરતે દ્વારા વર્ષની હતી અને મોતોની ડંભર સાત વર્ષની હતી. ભાતા પિતા બને ક્રીયાપ્રેરણ, સહગૃહી, પ્રમાણક અને મગનારણ હોવાથી અભાવિક રીતે બાળકેનાં પણ તે ચુંચ ડર્યાની દનાં તે ચાચે દાંપતી નાની વયમાંથી બાળકેને સારી રાતે નીનિસી અને ધાર્મિક ક્રીયાનાં આગામી કરતા હતા તથા ચામાયક, ગૂળ નિગરે ધાર્મિક ક્રીયા શીખાતા હતા.

મોહનવાલના શુદ્ધરસાથી કુરુણની સથળી ચિત્તા ગંગાના કુપર આપી પડી. પતિના મરણુથી તેને ઘણું દુઃખ લાગ્યું. એક પ્રેરી જોઈ, એક પ્રીજાના પાસામાં રહી આ ક્ષણિક અને દુઃખમય સંસારને સર્વેચ્છ અગામું હતું; તે નેડ અદિત થનાથી બંગાને અસ્વલ હિંદુશીરી થએ; તેના કદમ્બ હુપર મેરો આદાત લાગ્યો પણ તેણુંએ તે હિંદુશીરી બીજી અગ્નાન જીવિની જેમ માથું કુટ્ટામાં, છાતી કુટ્ટામાં, રાગડા લાંબું રણ કરવામાં કે ખુલ્લો પાળવામાં જતાની નહા તેણુંએ ધાર્મિક ક્રીયાનાં સારી રીતે લીપી હતી, સંસારનું સ્વરૂપ તે માનવતી હતી તેથી તેણું પોતાના ઉદાના ઉદ્ઘાન ઉદ્ઘાન સમગ્રીનાં. એસ કરતો ચાનગલદાની કુદુતાને લીન કોઈ પણ મોહનું નેર થતું, પતિ સાંચારી આતો, પોતાના ગર્ભિય સંસારના અનુક ચિત્તાનો ચુંબકતી લારે પણ તે બાળકોની ડાંડ નહા જરૂરનું ગાતે જરૂરનું ગાતે એકલી એરી હુદય આશી કરતી. બાળકોને તો તે દરેખાં ધીરજ કેની અને સમગ્રતા કે-નહારો રહાલાંનો! આ દુનિયા એક મુખાદરી છે જેણે તેનાં દરેક પ્રાણી મુખાદર છે. પોતાના કર્માનુસાર રણિત ધોર્ણી મુખાદરી મુખ ધોર્ણે મર્મની આપાથી આદ્યા જ્ઞાનું છે. આટે મરણ પાર્મિતાની દોષ ન કરતાં આપણું તેના શુદ્ધિનું રમણ્ય કરી તેણા જીવી થતું અને દૂનાં આપણી મુખાદરી આપણું સુખદ્રષ્ટ ધ્યાય તેણા વચ્ચે કરવા, આપણોનું

## માણિ માને મોતી.

૧૩૩

પોતે એ પ્રગાંભે સમજાવતી એટલું નહીં પણ પોતે પોતાનું વર્તેન પણ  
એટલું ડંગ રામાતી; તે ચાંદ હવે ગઠી મોતાનો ધરસંસાર એમ સુખદૃષ્ટિ  
આણે અને બાળમાં સારી રતે કાળાઈ એમ ચુંબી થાય એમ દરવાની દરજ  
મોકનદ્વારાના ચુલ્લરી જવાથી પોતાના ભાયે આવી પડેલી છે. એવું સાંન  
નતી અને તેને ભાડે ચિંતાદુર રહેતી.

મોકનદ્વારના ચુલ્લુ સમયે તેના ગંગાદમાં પુષ્કળ ખર્ચ થવાથી ધર્ષણ  
મોદી શીલક ગંગાના દ્વારા આણી રહી હતી. કરકસરથી ખર્ચ સાદાતનાં  
પણ ચંદ વર્ષે તે શીલક પુરી થાય ગઈ. પોતાના આવા તંગીના વખતમાં  
પણ તેણુંને બાળકેની ઉંગવણીમાં આગી આવવા દીધી નહેતી. પોતાના  
ઘણકેને સારી ઉંગવણી આપવામાં તેણુંને ડેટલીછુંઅશાઓ બાંધી હતી.  
અને એ આથામાં તેણુંને ઉંગવણીનું મોંબું કામ પ્રથમની ક્રેમજ થાડ  
રાખ્યું હતું. દવે તેણુંની તે સર્વ આશાઓ નિરાશાના રૂપમાં જણ્યાવા લાગી.  
પેર પુરતું આવાના ઝાંદાં લાગવા માંડયા તો ઉંગવણુંને, ખર્ચ પોતાથી  
કષ રીતે કૃપાદ્યે તેને ભાડે રંકદ્ય વિકદ્ય ભવા લાગ્યા.

ને હિસે ભણિલાલ મોતીને ભાડે દીરા શેહાણી પારો છાંધ કામ કેવા  
ગમે તેની એ મહીના અગાઉ ગંગાને પોતાના ધરખર્યનો દીસાખ લખ્યા,  
દિવાર ક્રોં તો તો તેને પોતાના ઉપર તંગી આવી પડેશ એમ લાગ્યું. ભણિ  
લાઈની આ વખતે અછું વર્ષની ઢંગર ખર્ચ હતી. તે સુઅધની નૃહાધરસુલખાં  
મેટ્રીક કલાસમાં હતો. અને આ વર્ષે પાણ થવા માટે અભ્યાસ ઉપર સારી  
મહેનત કરતો હતો. ગંગાને તે શરે મોતાના ચુંબ ગ્રસા પણી ભણિ ને કે  
પોતાનું વેરન વાંકડો લોનો તેની પણે જન્મ એંદંતમાં પોતાની સ્થિતિથી  
તો વાડેદ કર્ણી અને આજ ચુંબી નિશ્ચિંત રાખ્યો હતો તેને. ચિંતાદુર ક્રોં  
ના દીકશએ ડેટલીક વાગત ચુંબી ભરસત જવાતી. છેવટે ગંગા ને જીક  
ચલાનું જરત કામ કરતી હતી તે વધારે વખત કરવાતું અને ભણિભાદ્યે  
પોતાના અભ્યાસમની વખત નામારી એક છાકરાને ભણુંનવા જવું. અને  
દૂરખીનાં કાંધ માટે ચાય તેસ કરવાનું કરાયું. ભીજે હિસે ગંગાએ પોતા  
જીને જાણિની નાગીન ને પોતાની રાખીન સંદેશો હતો અને હાલ છેચે  
બિન દ્વારાયાં હતો તો જાણવાના આતાનું સુફર હું.

ગંગાના કાણકાંદરની તથા ગણિનાના પગારથી ધરનો ખર્ચ ગરી-

જાયા ખળું શીતસર ચાલવાની જ્ઞાના અધ્યાત્મ; ખળું રાગતા કામ કરવાની જરૂર કરીર હિતથે હિતથે લઘટું લગું હતું. તેણુંથી કામ વારે જ્ઞાન લઘું નિર્ધારું તો પણ પોતાના વદાની જ્ઞાનાની જ્ઞાના આપર તે જેવી જીવ જીવન એવી કામ કરતી હતી. તે પોતાના જ્ઞાનિત જ્ઞાનાની કંઈ જુદું છાડવાની હાજરાતની લખાતો ખળું પાપાં અભિજ્ઞાત કે વળું જુદુંની હતી. જ્ઞાને જારે રહુવાની હતી હાંઠ દેનાં અભિજ્ઞાતની હંદી વર્જન જ્ઞાનાની વદી તથા પોતાની સ્વિધિની જ્ઞાના વદી કરી જાહેર કરી જાયાની હતી કરી તેવી નહીં. તેણું કંઈ પણ કાર કરી પેતે જાહેર જાપણા કુંદા બતાવી આપે શાંતે તે ગાડે પોતેના જાહેરે જીવાશેદાયું પણે મેરાંને.

જે જીવિનાનાં અભિજ્ઞાત ઉત્ત્સર્વં શેષાં ધરમાં પરોધ્યા બણે હતો. તેના ચુશીદ રૂપાનથી ધરમાં ચરી જાગ્યો. તેના કાપર પાતે રાગતાં હતો. સર્વે જ્ઞાનાની અભિજ્ઞાતને જ્ઞાનીને હીરાશેદાયુંની જ્ઞાનાનું કાદળ પુરુષું અને લેણું પોતાની જ્હેનાની કામ કરવાની કુંદા જાગરી નના હોઈ જા મના જાગ્યું કરીનીચિરોદાયુંની ને વળું ગયુપણા જુદુના જ્ઞાના અને તે વધ તરવાન અભિજ્ઞાત જીવ દેનાં ગાંધીય જ્ઞાનો. પરે જ્ઞાના પણી પોતાની મની વાયોપત વિપેની કાંડાની અભિજ્ઞાત ચોંગ વંગાને જાણ્યા લાં ચુંચી ચલાયું; તે પોતાનું દુઃખ છાડવાનો જ્ઞાના જીવાશેદાયુંનાં નહીંતી ખળું આપે તો તે તરત જ્ઞાના વધ જાઈ હતી અને કુંદાની શક્તિ ખળું નિયેતી તેથા તેણું છેકરાયો માઝે જાતાના વિના જુટ્ટો નાણોની. સેહી ખાપાં હતી પણ મળ્ય કુરાશાયક અને સમજાયો હતો તેથા આપી નભળાયુંની તેના મનમાં અનેક તર્ક વિત્તું જ્ઞાના જાગ્યા. જ્ઞાના વધું તમાં પોતાની મા જ્ઞાની પડે તો ભાઈ ખણુંની શું સ્વિધિ થાય એ વિચારે તેના મનને વિત્તાતુર કરી સુધું. તેના પિતાને અને તેના જુલ્દીની પણી તેણુંની હિત અને શક્તિના પ્રમાણુંનો દરેક જાતાની સમજાયું જ્ઞાની હતી, રાહગુણું શીખજ્ઞાન હતો અને હૃતીના દારીના જાણુભાગી વાતો રાગતાની હતી, તેથા તે પોતાના વિતા ગંગાના રાખતો અને જાતા તથા ખણેના પણે ડિમાત જતાવતો. નથું ચાર હિતસા ગંગાની પરુણી બોગજ જાણી પણું પણેસે હિતો તેણુંને સાંત તથા જ્ઞાનો અને તે પચારીનું અછ પડી.

## મહિનુ રાત્રે મોતી.

૧૩૫

ગરીબાળની કંઠે આનુભવ થણો હેઠા તેનેજ તે વિચિત્રો ઘ્યારે આવે છે. જાં ગંગે લેખ પેસા અવૈષણવી છુટ અને વેગવાધ હેઠા જાં તરફી જાં કાંઈ કોણ હૃદય કોણાં ગઈ છે અને હરિયાતની મીળને માટે પણ કંઈ કોઈ રીતે રદ રાણું પડે છે તેણો અતુભવ થાયો થાયું. છતો કાંઈ કોઈ એણને વરાણસ કરતો ગરીબો તેના સહયુણોને લીધે સુખી અને પ્રેરી હેઠાથ નં. ગંગાના લસરાં ગરીબી હતી, આદ્ધત હતી છતો પણ કેનેને ગરીયાનું હૃદય લાગતું નહેણું. જાગડો પોતાની ગા પાસે કોઈ જાતની માગયી કરતોને નાંદો અને માતા પોતાની રહિતના. પ્રમાણમાં જીવાધરી તેણે ચર્ચી પ્રકારનું ચુખ આપવાનો આતુર રહેતો. બાળકોને જોતાની પ્રત્યે અંકુશનો રાખવાનો ટેચન પડી ગઈ હતી તેથી તેણોને તે સંભાળી કરતો પણ હૃદય લાગતું નહેણું પણ પોતાની રહાલી માના મંહવાધ્યા તેણો અલરાના. ગંગાએ પથરાત્માં પડ્યા ચડાના પણ તેણોને ધીરજ આપ્યો. જાં હાજરી ઓફ પીળની માંસો દિનના જાતાત્માં હતો પણ આનગીમાં સર્વના આંશિકાંથી આંશુ ચાલાં કરતો.

મણિયાદ તરફન કેઅતદો તેણી લાંબો અને દ્વા લાંબી આપવી શરૂ કરી. મોતીનો રૂકુલાંબીં યોગ હિતાની રૂન મંગાવી અને ધરતું પણું ગ્રામ કાગડી લીધું. આઠ દિવસ થાર પણ તાવ પીલાદુલ ઉત્તોં નહીં છતો વિશેત રણા તા કર્ણી કરી. રશને હિવસે તાવ ઓછા થયો, પ્રકૃતિ સુધરતી હૃદાધ, ડેકનરે જાહી આરાન થવાની આચારા બલાની અને છોકરાઓના મન શાંત થયાં. તે પણી એ વણ હિવસે ગંગાનો તાવ તહેન ગયો. પણ નખ, ઘાઉ ઘણી રહ્યી. પંદ્ર હિવસથી તેણોએ અનુ મુદ્દલ લીધું નહેણું. હવે ઝીંધક રૂપિ થયા લાગી હતી તેથી ડેકનરે હલડો ઓરાક તથા કુર્બેવા બલામણું કરી.

મણિબાધ નિયમસર રૂકુલાં નહોં હતો પણ તેહું મન ધેરજ રહેતું હતું. રૂકુલાંથી, રૂકુલો હતો કે પર્ણલીલ જાડીમાં તે ધેર આવતો. ઉત્તમયંદ શેદો ધેર લણ્ણાવવા નવાતું યોગ હિતસ તો શરૂ રાણ્ણું પણ પણી લાંબી પણ ચાર પંચ હિવસની રૂન મંગાવી હતો. તેની માની તણીકત જરા સુધુર ડિપર આપી કે તેણે પોતાનું તે કામ બરાબર બાળનવા માંથું મોનીં ઘરકાળનો પણુંત થણો ગાના ગંગાઢાણની શીકર છતો ગળુપદ્ય શુંધીને તેથાર કર્ણી હતા. તેણી માની તાવ ઉણોં તેણે જીજે હિવસે રહિવાર હતો. તેથી તે હિવસે ગોતિનો બાઈની માણે ગણુપદ્ય લઈ હિરશોદાણીને ત્યાં જવા, મા માણે આચારા નાણી અને તેણુંને આપ્યો.

६३५

## श्री केन धर्म प्रकाश

जिलारे अग्रे वर्षा रथी दृष्टिभवी भवतानी चेतानो मानो व्यापी  
परे खाली विग्रे जोहती वस्तु मुझ मातानी रन लभ जने वाह जुहन  
सुंध ज्ञा तेयार थ्या. गंगाने अन लक्ष भावतु नदेवु अने दोनरे  
हुई देवा भवासमु करी कली तेथा नीडगती यांतो गोलीमे वाढते कांग  
डे-वेक अरवी रुपियो आये लम के, आणेजे गांतो भाटे यांडु कूट खेल  
लेता आवाजे. भण्डिवाईच्ये ते वणते निराश भरेवे चढेऱे कांग के विद्य-  
कमा भाव ऐ आनाज के? आपा गनगां जिल येतो जी लाल निकाय,  
नन्दिराजा रेवते इतरी, दीर्घेवाल्लिमि ठिंगलो लाली नव्हेकर तो  
अस्ते तरा तां गेदेया. भाकरो फूलतो गावय वांगु के शेंगाळी जिलाया  
बांगुन नालिनो शाये लां वाकर गावा के अंत गणिताव आवे तो गोंगा-  
रंग अग छक्की यापेह. याकरे हिंगाजानु उपायी आपी तेंगोने येत्यार्थ.

हिंगाजानु विशाळ, सुंदर अने शण्यारेवु लातु. तेंगो टेपव, तेव,  
झुरसीमो, आराम झुरसीमो आरी रीते जोहवेली लती. वाते रसावनाना  
सुंदर विशेला तकाल्यो खांधेला लता. ओंशतलीमे सुंगाळो आवाजेना गाय-  
रेली इतो; अने ज्यां ल्लुवे त्यो डिंगती इरनीयर जोहवेकु लतु. छेक-  
दंगो एक ओय उपर योटी वर्षत ऐडा खलु भालक भवावनी चंवलता  
अने नातु नातु ज्येष्ठानी विलासाने तेंगो उह्या अने लांत उपरना विदो  
नेवा भांगु विशेली जेतां जेतां जेतानी नजर जोक खुँगु लीली द्राक्षी  
टोपली अरेली परी कली तेना उपर पटी. तां आपी जीं भाई ज्येष्ठ अ-  
रक्यां जेओनी गेनाहति ए भेनीसंबंद अने स्वाहित द्वा तरक् आकर्षित  
अने भगवार तेनी उपर वेष्ट रज्जा.

‘ लाल ! आगांधी आपेहे शोटी लापेहे तो ?’ गोलीमे क्लु.

आगांधी आपी आवानी वस्तु वेम वरत ते लेवा लक्ष्याय के. भाव  
विला तरडकी डांड पृथ रमनवु न आपत्तामां आपी हेय तो लेवा लाल  
ज्ञा ते ज्ञानांगु छे. अंगु अने भेलानी तेना गावा विलाजे नीति आ-  
वंगों सादो लेय आपेहे तेना तेथा लालवी तेना उपर जेवे कांगु पण तेना  
परा वांगु के न वांगु के विलारे नेवाने तेम करता आउकाया. गणिता  
ज्ञानांगो आपत्ते डोम नानांगु भरभर विलासी अंगताण धांगु लतु अने  
देवा तेलु डांड उनर आपेहे नाही.

‘ लाल ! तुं शोटी लाडु ?’ फरीचा गोलीमे क्लु.

## માર્ગ અને શૈખતી.

૧૩૭

મેંટો અન્યાં હતો, ચારા હતો, એ તેણી સમજાણુશક્તિ ક્ષારી અની તેથી તે દ્વારાની વિશ્વ પરંતુ તેણા જગતના ડાંડાણમાં નીતિઓધનાં કે વિજાતો જાળના અધ્યાત્મ ઉપાયોદ્યા હતા તેણી આચારથી કાર્યની શુદ્ધતા અન્યાં આદ્યજીવનો નિર્માણ ગાળ્યા બાળની આગ્ના માળયાના રિચારનો છુદ્ધ્યો બણે અને તે આગ્ના ગાળા પણ્ણો તેમણે એક પણ દ્વારા ક્ષેત્ર તેણી દિને મત જાહી નહીં. મણિના દ્વારાની તો એ પણ પણ પણુંસિ અને દૈવીઘૃતિની પરાયારી આવદી હતી અને તેથી તે ગરાય દ્વારાથી ગેતુ શું કલેણું તે પૂર્ણા રાણીની નહીં, રાગુજ અંગેની નહીં અની તેણો કુતર આપી શકશે. નહીં

પ્રેર પણ પ્રકારની આડારી કરુંં હોક ગાળ્યાના જાનમાં પ્રથમતો પ્રેરનાના પણ હતો અની તેણી નેણ હર્દાં આચારને છ પરંતુ તેણી ચેતના નિર્મિત-પાનાનીના પણ્ણો હોક, ચઢુણુંના આચાર હૃત્યમાં જગક્તો હોય અને રિચાર રિચાર કુપર આદ્યજી રસ્યાની રાણિ પ્રાત અછ હોય તોની રિચારા જન આગે છે; અનીં આશુદ્ધ રિચારો નેર કરે છે અને પરિનારોને અદ્દ કરે છે.

‘ બાળ ! કેમ આવદોં નહીં! આગામી દ્વારા વણી છે અને તેમાંથી આંખું મૌદી વધુંને તો દીરાંદીપણની અધ્યર પણ્ણો નહીં.’

નિંદા જાનના જાલ્યાની પ્રેરાના આડારની કોણો અધ્યર પરી જરો અને વેદ્યા કુદરતી અંદર રિચારથી આડારી કરતો કેટલીક વખત અચ્છેં છે, અનુ અધ્યર ગરુદાની અંદર કુદરતી જાણારી બાતિ ન હોય લાં તેઓ આશુદ્ધ રિચારની વસા અથી નથી છે, વાલયાના રસાય છે અને આકારી કરે છે. તે આંખ જાનના આવારથી, નાનિધિન્દ્રા કાર્દિશની આગીથી તેઓને સુસ્તુંની કે જાના રસ્યાનીનોંનો શરીર જાણ રસાયાનું છ અને આકારીથી બંધાતાં અધ્યર કોઈ હોથીનોંનો અધ્યર ગરે કે ન ગરે તો ગણું અન્યાય છે અને તેણા જાણ આગામાંનું પડે છે.

નિરાંદેશાયુદ્ધીની અધ્યર નહીં હોડ એ દ્વારાથી વાવણે મણિના હૃત્ય અધ્યર કોર કરું અને તેણી રિશબ્ધ ગાળની. પાલદ હૃત્ય કુપર જરથારિતની અધ્યર વર્તીણું અંદર રિચારથી વિશ આમણી હત્યો.

‘ જેણા ! હું તે આગામે આરી હોય પણ્ણો નથી પણ આપણી રાગુજ અંગે જોડો હોય તેણું હોય !’

અન્યુંના સુનાયા જેણાની હોડ જાણ કરતુંનો છુટા નદોતી અલુ પોતાની

સ્વાત્મા ગતાને અટકોણી અધ્યત્વ વસ્તુની અધ્યારે જીવરીયાત અને પેશ્યું  
વાગ્યાને લાય તે ક્ષેત્રાંતિ દેવાની અધ્યાત્મ-કોનિયાશેખાને હેઠું આપ નિર્જા  
થતું હતું અને અધ્યાત્મ દિવારોનું બેર થતું હતું.

‘ભાઈ! લારે હું થોડી હંડાં હું કૃતી ગેરાણે રોક પ્રથ મુજબ  
ચારુંદીનું જીવની જરૂરીનાં કોણીયાના ગર્ભની જીવની ગર્ભ એ  
અનુભૂતિ હોર કરી રહી અની વિશ્વાસીની ગર્ભની જીવની ગર્ભ એ  
દેખું હોયાં અંતિમાં હોર જીવની કાંઈક જીવની હોયાં હોયાં  
ને હોયાર કરી વિશ્વાસી નાનું હોયાં, ત્યારી કર્ણાં કુણિ નિર્જા  
કરી હોયાં હોયાં પ્રાણિકુણાંનું જીવની, જીવ જીવની હોયાં હોયાં હ  
નુંનિંદ હોયાન હોયાં હોયાં, જીવની હોયાની જીવનાંની જીવની હોયાં  
હોયાં હોયાં હોયાં, ત્યારી કોણી હોયાર હોયાં હોયાં  
વિશ્વાસ હોયાં અની વીણાનીની જુદીની નરાની જીવની હોયાં, એ  
ખોલાણી અની જીવાની આરા હોયાં, ક્ષારે જીવી કાંઈ પણ જીવની  
કારી હરાં વિશ્વાર થાય, ત્યારી ગોણાની હોય હરાં દાખાયા, લારે હોય  
વધાન હોય હોય જીવી હોયાં વિશ્વાસની અની પરમાત્માને હળ ડ્રો હોય  
અંતકરણું દ્યાં દ્યાં પરદીદાયા હોય હોયાં; હોય હોય જીવની  
પ્રાણી, વિશુદ્ધ રહી હોયાં અને આદી હોયાની મહાન વિદ્ય હોયાં’

તેની ગતાને કેન્દ્રાનેની દ્વારા ગદાયિયા હોય હોય હોયાં કરી, મધ્યુંન  
તે હોય હોયી ખાણો ખાણી અધ્યાત્માન કરી વધુરે હોય હોય હોયાં રોની રાગનાની  
ઘૂરી વિશ્વાસાં તેખીએ સમજનાનું હતું કે— કોઈની પણ કિંગની અધ્ય  
વધાર કિંગની વરતુ હોય હોય હોય અધ્યાત્મા હોયાં હોયાં હોયાં હોયાં  
હોયાં હોયાં હોયાં હોયાં હોયાં હોયાં હોયાં હોયાં હોયાં હોયાં હોયાં  
અની હોયાં  
હોયાં હોયાં હોયાં હોયાં હોયાં હોયાં હોયાં હોયાં હોયાં હોયાં હોયાં

હોય હોયાં  
અને હોયાં  
હોયાં હોયાં હોયાં હોયાં હોયાં હોયાં હોયાં હોયાં હોયાં હોયાં હોયાં હોયાં  
હોયાં હોયાં હોયાં હોયાં હોયાં હોયાં હોયાં હોયાં હોયાં હોયાં હોયાં હોયાં

## અન્તિમ પ્રાતો.

૧૩૬

શય પાણો જેંચો અને કદું-બોલી આઈની ખણુ ડિભતી ચ્યથની વિગર  
હિંસાની વિશુ કથા નિના અથવા આપણા વિના દેરી તેથી પાપ વિશું  
કદું માંને આપણને સમનાનું છે તે બુની કદું ન જોઈએ.

“નાના વાળો છે” અને ગુણદી બોલાઓ તરફના ગોતાનો હાથ જેંચી  
થીં કદું વિગરાનું તેને બાદ આપા આને તે બુની પોતે અકાને કરવા  
જુની નીંને ગાડે પદસપલ થાપ લાગેનો અને બોલી “ભાઈ! મને આપા  
કિંદાની પણ જાપનું દશે?”

“એના! માંને આપણને શાખાનું ની કે મનમાં ખરાખ વિચાર કરવાથી  
ખણુ પાપ કરો છે. જ્યા વાળોને તો વારા નેનાન મારા મનમાં મલીની વિના  
જે આપણા તેથી તું પાપ વિગરાન કરું; કરણ ને તું નાનો છે અને  
તું મોટો ના!”

“નાના! ખણુ મેંથી કાજ હેત્યા લાઘ વાયાનો કહો તેથી મને વધારે  
જી વાયદું હશે; ગાઢો જ્યા જાપ કરું હારે તે મારા ઉપર ડેવાયું  
કે થશે?” ગોતા બોલી.

“માતાજી આપણને દરરોજ ચારો સારી શિખાનું આપેછે, તે વિને  
મરી રીતે જાળ્યાન કરી આપણની ચાગનાંની સુગારી ચ્યાથવા બોધ આપ્યો  
ની છોં આપણે તેની શિશ્યા જીવા કરું જરાંખ કાગ કરવા છાંચા કરીએ,  
જીથા જાપે માર્ગતીંને તો હોં આપણા તરફ જોદું કાગે તેમાંથું નવાઈ  
જાતાને કેર વાઈ માંને સાંચાની જાત કરું અને મારી માગશું મલિયો કલ્યું.”

“જાણિયુંબાઈ! માનની પારો કરું આપણે મારી માગશું ખણુ પાપ વાયદું  
નીકળ જુટશો!”

“તેને મારું પણ આપણે મારું કહેશો તે પ્રમાણે કરશું?”

“પરનું જ્યા આપણનું જાહ કરશે? અને આપણે પાપરહિત થઈએ  
તો રહ્યો જાપાશે?”

“જાવાનાં તો પાપરહિત થશે અની તમારી મા તમને માઈ કરશે.

“દીર્ઘરીયાનું હો કરુંની જાપાનાનામાં આવ્યાં હતાં અને  
જી બહુનનાં જીવ જાત જાંબગનાં હતાં તેણા બોલી ઉદ્ઘાનો.

“પોતાનાં આપા મરીન વિગરાની દીર્ઘીયાનાનું ખબર પડી તેથી અને  
જી ખંડન શરૂઆત ગયા, મનેતાની આપણાં અંધું આતી જાંન અને એની  
પાપાન્યા નિનો રહણ ઉગા રહણ.

‘आहुसंगो ! गारा वडावा लाघवांगो ! आही आयो. तो अदीन नदी. तमारी शुद्धे माझी भगी शें तेना के अंत तगां खाय खणु र अभ शें तेनु के गाए तगां गारी भगाई आयो तेना आपलुक्त थें नेंगो आकारी करवानो विचार करे के, आकारी करवा तैयार थाय के तेजो गणु गवां शुद्ध विचार आवां ठें आकारी करवां आहो को गेलाना गवान विचारने भाए पथाचाप करे तो तेनु खाय निर्दिती बाय के जोटी रह थाय के ओम आपणा शास्त्रिंगो कळु छ. गाए तो निर्दा न करां अंत खणु आकारी करवानो विचार खणु न आए ऑही तगारा गवां मां हळता करो.’ ए प्रमाणे तेजोने आधारान आंगी दीरा शेषाशुद्धी गेंतीजे बुधेवा गवापदा लेंया. तेष्टीना ते कामशी तेजो शुद्धी थगा अने तेनी शेषात करतां खारे गवां आप्यु. अशी गण्डिमाई तरकू इरी तेने कळु. ‘गण्डिवाव ! आने वारे ओही शुद्ध गवां गाए ले नगीनो अ-क्षाय करवावा शेषात्तश नवो. आने विचार के अंत तेजी इं तो रुच आप्यु झु. तमारी आ गांवे के गाए तेनी गाए वडेवा व्हा तेनी सेवा याही करो’ तेजो तरतन उड्या अंत आवावा तैयार थाया.

आपणा इति द्रव्य संथादथी कळेवाता शेषांगो, दीया गेण्यवाची कळेवाता निधानो, अग्निनी इनि प्रमाणे भेवावाची गवां गवाता आणेनां अंत बोडविने प्रिय लांगे तेवा आपणा करी कळेवाता शेषुलोंनि आ जापांडीगो. कुद्र दोप-नवी गवां नेवें दोप-दोपांग लागणे, खणु तेजो पेताना व्यंग्यार्थ, व्यवस्यामगां, गृहव्यवस्यासमां अने रामुदायिक व्याधारण्यं देवा अपगाणिकप्रये वर्ते के अने ते अपगाणिकता दोपांग नवीं वेणां शुद्धुडग देणवे के तेनी आत्मनिरीक्षण निना-हरेक कार्य करतां तेनी शास-सार विचारवानी निजारा विना शु अपरप्रये. वाचनार। अग्निनी दोप काळतां पेतेवा हरेक काळना विचारने व्यवस्याने विचारने, सामा भाष्यासो होय शेषाना-करवाना शु संनेहें के ते उगर लक्ष आगां अंत अशी तेंगा होय काळाने येणा थकें; ओहुं नवी, खणु नंद दगिंगे इतिंगी होप दृष्टाय ते दगिंगे ताचां चर्चे दृत्यांगी तुवाना करो.

हीयशेषाण्णी ब्रह्म, विचार अंतदरवणवापी. लागु अने गदगुणी प्रये प्रेमवाचासां नवी. आगांता आ व्यविवही तेना उत्तरां तेजो अंत अने तेनी शहव्याणी गवावा उगर आर्दिक प्रेय किंवा धर्मी नवी,

## મહિનુ અને મતો.

૧૪૨

તું પણ તમારી સાચે તગારી ગાતે નેવા આવું છું ? એમ કહી તે શ્રીએ-પાળકાંને કરા જાર થાગાયા. તરતજ ગાડી આવી અને તેમાં મહિને સાચે બેસારી સ્ટેશને ગયા. આ વાગ્તા દીરશેહાણીએ અરધી ટ્રેપલી એવી પ્રાણ તથા શીંગાં સંતરાં નારણી નિશેરે ઇનો સાચે લઈ લીધાં હત્તાં.

તેણી બાંધું કોણ્ણું બોવાનારી અને અંતઃકરણુંમાં સમજનનારી હતી જ્ઞાન સ્વતાન્ત્રાં તેના કિહગાર નીકળા વિના રહ્યા નહીં. બાળકાંને ઉદ્દેશનાં તૈવાણી કંચું વહાલાં બન્યાંગો તમારી વર્તણુંક નોંધ છું ખાડું ખુશી થાં કૂદું. કેચો પ્રમાણિકાણું વર્તો છે તેણો સુખી થાય છે અને તેમે મહિની રીતનું વર્તાન સહકાળ રાખશો તો સુખી થશોન. તમારી ભાતાણી તથને આવી શિક્ષા અને સહાય આપાયા છે એ તેણીની ખુલ્લાણાને તું વચાની બનાતિ હે. આવી ગાતા સોંકડે બોકન હોય છે; પણ જે માતાઓ સુખરને તગારી ગા કેન્દ્રી ખરી ગાતા થાયતો આપણી કોમનો જલદી ઉદ્ઘ થાય.

તેણો રાત્રિ ભાલીમ ગંઠોચ્ચા. દીરશેહાણીએ ગંગાની તણીયતના સમાચાર પ્રદ્યા, કેટલોક આચારના આવી અને પછી તેના બાળકાના દ્રાક્ષ ગંગાંધી વર્તનાની વર્તાં કથી બાતારી તે સાંચેજ પેલી દ્રાક્ષ અને ઇનોની ભરેલી ટ્રેપલી તેણીને આવી અને કંચું—“ખંખન ! તું આ ઇનો વાપરને બીજી નોંધો તો મંગાને અને લારી તણીયતના સમાચાર હમેશા મહિનાલાં સાંચે ગેડકલને. તારી જેવી ભાતાણી આ બાળકો ભાગ્યશાળા છે અને એવું આપણિથી તું નરીય જ્ઞાન વરંગર છે.’ ઉક્તી વખતે તેણું મહિના હાથમાં દ્વારાપણાની સોંદર્ય આપ્યો અને કંચું કં-ચું નોંધ વાતે મુંઝોદશ નહીં અને તારી ગા માટે દ્વારા નિશેરે ને વચ્ચું નોંધો તેલારી તેની યોગ્ય સત્તવાર કરને.

દીરશેહાણીએ આવી ગાળાણું અને સખી પ્રદૃતિ માટે ભાતા અને બાળકો સુખી થયા અને તેણો તથા તેણુંના નેવા ડ્વાર માલુસનો સંનોગ પાંત થયા માટે પરયાળનો આમાર માતના લાગ્યા. તેના રૂણાં પછી ગંગાણો મળ્યું અને રેણુની પણો બેસારી કંચું—“મારાં વહાલાંઓ ! જેણી પરમાત્મા ઉપર આસ્થા રાખે છે તેને ન હોય લાંધો. સહાય આવી મળે છે. દીરશેહાણી અરેખરી કિરાર અને સુન છે. મહોદાધરનાં ઐરંગો તોઢીં, જાગન્ય અને જર્ણીએ હોય છે. મહોદાહરના તે દોપથી તેણો સુક્તા છે. થીજું ચંદ્રાંગોની જેટ ઇસેશાં મંદ્રાંગોને લ્યાંજ બન્ય છે, ગરાણોને કોઈ સંબન્ધ પણ નથી. પરંતુ ખરા ગરીણોને મહા કરવાથી કેટલો દ્રાગ્યદો છે તે.

४४२

## श्री जैन वर्षी अकाश।

आपसा अने दीर्घोहासीना चंचलत्वी चमचल केंद्र, बालिका । जो तपारि  
द्वारा इत्याहास महिला आपो उपर आवे तो आ तत आनन्दा द्व  
अने आर्द्धसंसारी केंद्र वर्तन सम्भाव शाखाते ।

इति किंचि गंगाने असारण वह गयो, आनुवादिक शिलालिपि अनुवाद  
अनुवाद इसी ते वर्णे निर्मलाक्षिकामध्ये अदेवा प्रवाचन करो. अतीते तिरु गमने  
द्वेष प्रवाचने ते श्री श्री आं पात्र श्रीमा श्री श्री विष्णु अन्नपादा करो  
केंद्र असारणत्वी अवागमक्षिकामध्ये तो अनुवादाक्षिकी केंद्र जीवाश्रमां शास  
गिरिशरीखां भविष्यतावने शिलालिपि प्रवाचन गोपकरा कृपर इति अपि ते शिलालिपि करो  
अपि तो उत्तरीक्षण विश्वामित्र आपो शिलालिपि आद्यां आनन्दा अपि  
तो तो अनुवादां विश्वामित्र आपो शिलालिपि शिलालिपि विश्वामित्र विश्वामित्र  
एवं अनुवाद इति ते अवागमे वह अवागम अनुवाद उत्तरामां उत्तरा  
द्वेष उत्तरामां अवागम गो तो अनुवाद एवं श्री आं पात्र श्रीमा अवागम  
उत्तरामां तो अवागम आपो श्री आं पात्र श्रीमा अवागम उत्तरामां अवागम  
गो तो अनुवाद अनुवाद उत्तरामां उत्तरामां अनुवाद अनुवाद अवागम  
गो तो अनुवाद अनुवाद अनुवाद अनुवाद अनुवाद अनुवाद अनुवाद अनुवाद ॥

शहनामी गंगालिपि अनुवादाक्षिकी अपि अनुवाद आ तो शहनामी अनुवाद  
अपि अनुवाद अपि; अपि अनुवाद अपि, अनुवाद अपि अनुवाद अपि  
अनुवाद अपि  
अपि अपि अपि अपि अपि अपि अपि अपि अपि अपि अपि अपि अपि अपि अपि

जीवनार! आ नामी नामाशी अपट्टोन नामी केवला कु द अपि  
शहनामी शुद्ध वर्तो अवागमी आनुवाद अनुवाद शहनामी अपि अनुवाद  
आपो आपा शुभमां वर्तो शहनामी तु तो आपाद देवो तो आपो अपो अपो  
शहनामी अपि तो अवागम अवागम अवागम अवागम अवागम अवागम अवागम  
तो अपि तो अपि  
देवो तो अपि  
देवो तो अपि ॥

A.

શુદ્ધતારૂપની પહોંચ.

૧૪૩

## પુસ્તકોની પહોંચ.

### બર્ગ વૈદ્યને પરોપાદાર;

બર્ગોદ નિવાસી ગુરુલાલીમાણસજીએ “ધર્મ કોઈદે પ્રેરણાસ્કરણ” એ નાગની ચૂક પછીની એક જ્ઞાનો ડિગ્નિત રાણીને ખાડાર પાડી છે. તેના વરસ્તુની તેના એક નાના અભિનપ્રાય માટે આગને ભળીછે. સફરથું ખૂબું અનુભૂત અને વાણી લોચ છે. તેના અને વસ્તુ ગાંધે પર હરાણી તે સર્વેનું વાં હરાણું કેવું ધર્મ? એહે પરેપાદારનું હરાણ ધર્મ છે અને હરાણ હરાણું, પુરુષ, જાણાંધું, જીવનું, જીનનું, નાનાનું, શરીરની ચાંગઠીન, પાંચનાં, માણાંનું, કોકાણું, જીનું, વાણું, જીવનું, પરખમાંનું, પરખમાંનું, અથ આજા નાના પાણન જાણાંનું અને પાણપણનું લાલું કેમ કરાણું? કેને કેનેની પારી દેંક ચાણાણાં નિદ્રા ભરેલું લખાણું કરેલું છે; અને પાણનાંની અનુ ચાંદ તેવી ગાણણું કરી છે.

તેણું ખુદોં પરખમાંનું લાલું કેચુ કરાણું? એ મથાળાં નીચે અન્યાં હોય નિદ્રા, જીવનાં વાણું પણો ખુદોં મર્તિભિંન ઉપર ઉંઠતી હોય છે, જોં હોય અન્યાં જીવિ વાણાં થઈ જાયા કરી તે અન્યાં અન્યાંને કરી છે અન્યાં જીવાનો કરાણો પાણન પુરેખરો આદેશ છે. આ જીવાનાં જીવાનાં જીવાની નિદ્રાની કોણાં માત્ર જાણ છે કે જાળજીની તો જીવાન હરાણાં અને દેંક વિશેષાં આનાનાની વાણાં થયેલા મર્તિપુનનું અંને લાલાં જીવાનાં દેંક જીવાનાની નિદ્રા કરાણો અન્યે કેટાંબણું અહિત કરેશે. મિન્દાનાં જીવાનાં જીવાનાં નથી. કોણાં સાહેણ લખે છે કે;—

“જીવાની જીવાને મારે જીવાનાં પોતાનું જારી કરવાની ઘૂંઘાણે જુદી જુદી જીવાનાં કોણ જીવાના આના છ. તેણો જુવા જુવા દેવોની મર્તિ મારી તેણે હોય જીવાની, ખૂબ કંઈ તેણે રાણ કરવા અને પણ તેમની પાંચાંથી જીંદ હશે જીંદાનું જો હેઠેં વધું વધું જી. વાલેંચી છ. તીંબેકરે જીવાન કોણી અન્યાં અનુ વહી ને જીવાને દેખાયો દીધી દોતો, પરંતુ પાછળથી જીવાન જીવાન પરેપાદારની અને નિદ્રવાચી થયા નહિ એટા સ્વાર્થે પ્રવેશ કરે અને કોણેં તે અનુભૂત હોયાણી ચાંચીન ચાંદેશાઠથી મર્તિ દ્વારાં રસ, હુનિયાના તમાગ બનેન્ના તે પ્રચાણે થકું છે એટા આપણે તેમાં આંદોલન પણ જીવાનાં નથી. હુનિયાનાં થર્બ સ્વર્ગો તમાગ હોંણો જ્યારે વિશેષ જીવાન લંઘાનું હશે અને તમાં હુંદોંના દેંક રૂપાંને ચરે અને નથી અમ આતી નથી. એટાં હુંદોંની પણી ગુરું, અને પોતાના કર્તવ્યકર્માપરન પોતાનો અનુ જીવાનાર જાણાં”

સ્વાધીનું વાણાં અનુ પોતાના જીવાના વાણાણે કે જેણો પ્રતિમાના સંસ્કરણ જીવા જોગા કરજાન ને હેઠળની કરે છે તેમને તથા મર્તિપુનનું નહિ. જીવાનારાનેથી નહીં જીવાના પ્રાણ કરાણાર હોણ જ્યારીરામાણ વિગેરને

४४६

## શ્રી કેતા જીની પત્રાણા.

ઓખાળાણ આપણે હોકે તમે આ કરવું રહેલા થિએ. જ્યાએ તમારી જોગી મૌખિક વાદું થાએ લાએ ગાતરની ગેજે અર્થી એડી હેઠો. ત્યારાં ચાલાણ્યો હોય હોય ગોયાની જેમ વધારે નાડું ફક્રદો. <sup>१</sup> આ ઓખાળાણ જ્યા કેરી ગનના હોય.

આ પ્રગણું સંખ્યા એવી હેડે પરીયાં (મુખલેલા, પારસી, ઉદ્દીપા તામામની) રહેણા થયા લાએ હોય ગ્રામ થાણું લાંબું રહ્યું હૈ.

આ અણાણાં હોના તામામ કેળાની અદ્દી નૃત્ય ચાલાણાં જ્યા નિર્દેશન પણ અની તે કેમ ન રાંધ્રાણાં ચાલાણાં કરવાના હોલ્ડિંગ્સ એવો અનેહ તેનું વાણાણ ગાંધીયા આએ પ્રયત્ન કરનારા અછો, તેણું રિંગ વાણાં હીન્દુંના નથી. તેણો પણ ૪૦ આ બણે છે કે-ઈ સૂર્તિ મુલ્લિંગર ઘણ્યા કાળજી વાણ ચુફ્ટી તાણાં હેસણ્યાં તથા હોકેસાં કાઢી આવે છે. વચ્ચાં રાંધ્રાણું લાંદાણ એવી કરવું, પણ તું પાછળાની હો ઇન્દીન દુષ્પણ મનું આપો એકાંતે રેણું લાંદા હો જાઓ હોય તરફાનો નીકળાં રહ્યું હોય નથી.<sup>૨</sup>

આ વાણાણ લાખાં ડેફિન્ડ કાણાં હોય હો, એજ હોમનો હેતુ રૂપી વાંદો હો. કરણું હે પ્રથમ તો આર્ટી હુટી, વચ્ચાં એવી કર્સીની હો ગ્રાન્ટી ટ્રાન્ઝલ થાય એંગ વાણ્યું હો; એટલે પર્સીની સર્વાચાતણાં હોવી હોય. વચ્ચાં હુસ્ટિનાણો જોણા સંખ્યા થોરાં તેણોણે એવી કરવા હો ગયો અને લૂધ્યાન્યું એવી દેરેક ઘરમાં વાંની પણ્યો એંગેં રહે થાણાટરાં હુસ્ટિનો હેણો ગંગણો હો દ્યમણ્યું થયો વર્ગી આણસાન્યું હોણાં હો એંગ રાસ્ટ્રાં આપે વચ્ચાં ઘરોણાં સંખ્યાનું ગણે તેણે તે વાત કરું કરવા હોવી રહ્યે છે. આ ભાગાણાં આગે વધારે વાણાં હીન્દુંના નથી.

પસ્ટર્સિનું ભાલું કરવાના વિષયના પારંબનાં ગંગોડેંગ વાણાં થેથેદી ચાર્ચાંદ્યમાં પણ એટલું ખાનું તેણું અનાનાણનું સંસાર્યેં દેવું વાણ્યું હે તથાં આંદેશાનો પ્રથમની સ્થિતિનો એટલીંગ્યા કન્ફિન જલાણી હે કે વાણાં અનેંતે નિર્દેશકાર આવે છે. આપણે આર્દ્ધિંદ્ર એંગાં હેણણાં વિષયોં હો એણો નંગાણી ચિચ્ચિતમાં ડેરી વણને હોતો એવું હુસ્ટિનું પરમશાસ્ત્રાં વણ્યાં નથી તેમના ડેરેપિયુ મર્ગનાં નેતાઓનું તેરું માનણું નથી, નંધી એવી માત્ર કરણાણો વધ્યોને આંગેં પણ મારા કન્ફિન પર્સીનાં ચુક્કાં હો એવું હોયનીય હો.

આ ચુક્ક બાળશ્રોણે વાંદાને બદ્દો ન ચાંદાણની “પસ્ટર્સિનું ભાલું કરે કરવું” એ વિષયને બઢો આપે આપ ભાગાણાં કરીએ છીએ શિખાય તેમના લાખાણ્યું અંદન કરવાની આત્મ વિશેષ આણસાણતા ન ખૂબાણી આ એંગ કુટ્ટાણ્યાં એવી કરીએ છાંદો.

## ચરિતાવળી.

આ મુહૂર્તના બે લાગ અલ્પાર પદ્ધતા છે. અંદર કથાઓ અણી રહીક છે. એવા નાવેલા વાંચવાને જરૂરે આ યુકો વાંચવાની જરૂર આપ હાલામણ કરીએ છીએ. આ યુક વાંચ્યતાં એટલો કૃત પડ તેમ છે કે વાંચવાર તેમ પરી જુદી શરૂ નહીં. વિશેપમાં વર્ણાદિતો પણ ગાયુદ્ય લાલ ભાગી શરૂ તેમ છે.

શ્રી કૈનાર્દિસ પ્રકાશના આહુકોને ખાટ એ મુકની કિંમત ક્રમિને ૩.૧) દરેક લાગની લેવા ડરાયું છે. કાઈપણ પ્રકારે ૭૫ રૂપી વાંચન ડેલાવો પામે એ આગામી આંતાંકરજૂનો હેતુ છે.

દરેક લાગની અંદરના વિલાગો ઉછરતી વધ્યના પ્રાણોને મુલાખ આપવા યોગ્ય છે. તેથી તેવા હેતુએ મંજૂષનાર પાસોથી મંજીલી કિંમત રસ્તાં પોણી કિંમત લેવાનું મુકરે રહ્યું છે.

આ યુકોના રાખ્યાના એટલું જ લખયું થસ છે કે શ્રીકૃષ્ણ  
નું એ ન આપી કરો!

એનો લાગ પણ યાડા વર્ષતમાં અલ્પાર પદ્ધતે તેમાં જોયો  
તીવા ક સરિયોના કાપાંતરો આપરો. વાર્તા વાંચવાના રસીયા  
નિન અંદુંઘાંય બીજી યુકો વાંચ્યા કરતાં આવી યુકોજ વાંચ્યા  
નાથ છે. આ યુકોનું પાઠરીંગ વિજેતે બાદ સુંદર કરાવેલું છે.

## લેખકોને જારીરહું.

“કોનોનાં જાહેર આતાં અને તેની હાલાની સ્થિતિ” એ વિપદ  
નિર જોયી સારો નિયંત્ર લખી માંકલાનારને ‘શ્રી કૈન સુસેન્ઝિન  
નિર અંગ’ (લસ્ટથી ૩.૧૧) તું છનામ આપવામાં આવરો. છેલ્લામાં  
(ા આંતો વદ્દો)) જુદી આવેલા લેખો કષુલ રાખવામાં આત  
થી આટે તે દરમયાન લેખકોને લોય માંકલવા.

અપાગાવી  
સુંદરા

લલુભાઇ કરમચંદ દલાલ.

અણ, રોડેસરી, લેન્, શુ., મિત્ર મંડળ

## કૃતી કૈન્દ્રિક મસારક સભાના લાઇટ મેઘબરોને લેટા

નીચે જગ્યાવેલી ખૂંડો લાઇટ મેઘબરોને બેટ આપવાનું મુજબ  
કસરાનાં આંધું છુંટેથી તે ખૂંડો લાઇટ મેઘબરોએ પોતાનાંથી  
મંગાવી સેવી; નહિતો ઐસેજ પૂરતા વેલ્યુપેલ્લથી મોકલીને  
વાણાં આવશે.

|    |  |                |                   |      |
|----|--|----------------|-------------------|------|
| ૧  | અરિતાલદી લાગ રૂલો ...  | ...            | ...               | ૧-૦- |
| ૨  | અરિતાલદી લાગ રૂલો ...  | ...            | ...               | ૧-૦- |
| ૩  | શ્રી તિપદિ સભાના હુરપ અરિત્ર મૂળ પર્વ ૨ લું                            | ...            | ૧-૦-              |      |
| ૪  | સદર  | મૂળ પર્વ ૨ લું | ૦-૧૨-             |      |
| ૫  | શ્રી ખંચ ભર્વિકાશનું ચૂંગ શાચી ...                                     | ...            | ...               | ૦-૧- |
| ૬  | શ્રી યે પ્રતિકાશનું ચૂંગ " "   | ...            | ...               | ૦-૧- |
| ૭  | શ્રી કૈન્દ્રિકાન સામાયક સૂત્રાદ્ય ...                                  | ...            | ...               | ૦-૧- |
| ૮  | શ્રી પચાસાલાંક તથા પંચશાળાની મૂળ ...                                   | ...            | ...               | ૦-૧- |
| ૯  | શ્રી સનાતપુષ્ટ, સનાતસંહી પૂજા તથા વીરાચાનકાની<br>પૂજા (ચારામાં અણ રૂટ) | ...            | ...               | ૦-૧- |
| ૧૦ | શ્રી કૈન્દ્રિકાન ખાલીલી (ધુજશરી).                                      | ...            | ...               | ૦-૧- |
| ૧૧ | શ્રી પોલાલ નિવિ... ...   | ...            | સર્વને ખરો સેદ્ધા | ૧    |
| ૧૨ | શ્રી માનનગર ગૈન તિરેકદી.   | ...            | ...               | ૦-૧- |

જા તિપાય નીચે જગ્યાવેલી ખૂંડો સભાના લાગ મૂળ  
સભાનારોને નીચે લગેલી કિંમતાદી પોણી કિંમતે ખરી રાતાં  
જાળાયા તિપદર લોય તેમણે ઉપરની ખૂંડોની સાર્વિજ અંગારીનીં  
૧ શ્રી શર્વિલ્લું માલાતસ્ય લાયાંતર. ... ... ૧-૮-

૨ તિપદિ સભાના હુરપ અરિત્ર લાયાંતર પર્વ ૨ લું.૨ રૂણ.૨-૪-

૩ સદર " પર્વ ૮ રૂણ.૮ રૂણ.૧-૧૨-

૪ સદર " પર્વ ૧૦ રૂણ.૧-૧૮-

૫ શ્રી ઉપરિલિત લાવપ્રાયાના પીડાંખલું લાયાંતર. ૦-૧૨-

૬ શ્રી વર્ષિમાન દ્વારાંશીકા ... ... ૦-૩-

૭ શ્રી સતનોભર રતનવતી ઉદ્ઘાનાં ... ... ૦-૪-

ઉપર લગેલી તમામ ખૂંડો પહેલા તથા અણા જરીના સે  
ઝરને ખૂંડું મૂળ કિંમતાદી પોણી કિંમતે ખરી રાતાં; તેથી છદ્દ  
કુચ તેમણે ખેંચાયની પોસ્ટરાન્દી છુદું સમજતું.

ખા ચોપાનીયું અમદાવાડ-૬ એંગલ્સ વર્નાર્થયુલર પ્રિન્ટર્સ  
પ્રેસાંમાં રાખાયાએ રતનવતી આરકૃતીયાને રજુઓનું.